

78 78 5 91 0 92 પર GK લખી વોટ્સેપ પર સેન્ડ કરો.

Current affairs 353 (1) સામાન્ય જ્ઞાન 6-2-2017

Page-1

રાષ્ટ્રીય

- ૧) લોકેશનના આધારે હવેથી સરકાર ઘરના રહેણાંકને પણ ડીઝીટલ નંબર આપશે, દરેક ઘરના લોકેશનને આધારે યુનિક ડીઝીટલ નંબરીંગ સીસ્ટમ બનશે.
- ૨) હાલ ભારતની આર્થિક બાબતોના સચિવ તરીકે શશીકાંત દાસ ફરજ બજાવી રહ્યા છે.
- ૩) અરબી સમુદ્રની રાણી તરીકે દક્ષિણ ભારતના કોચીન શહેરને ઓળખવામાં આવે છે.
- ૪) 4 ફેબ્રુઆરી 2017 ના રોજ રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રપતિભવનમાં વાર્ષિક ઉદ્યાનોત્સવનો પ્રારંભ કર્યો હતો.
- ૫) ભારતીય રેલવેના પશ્ચિમ ઝોનમાં ટ્રેનોની ઝડપ વધારવા માટેની મંજુરી આપી દેવામાં આવેલ છે, મુંબઈથી દિલ્હીનું અંતર 12 કલાકમાં કાપી શકાશે.

આંતરરાષ્ટ્રીય

- ૬) ભારત-પાકિસ્તાનના હાઈ કમિશનર અબ્દુલ બાસિતને ત્યાંની સરકાર દ્વારા નવા વિદેશ સચિવ બનાવ્યા છે.
- ૭) ભારતીય મૂળના ત્રણ નાગરિકોને ઓસ્ટ્રેલીયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન મળેલ છે.
- ૮) રશિયાના એક પક્ષી ઘરમાં લાઈગરનો જન્મ થયો છે, તેને બકરીના દુધથી ઉછેરવામાં આવી રહેલ છે.
- ૯) સમગ્ર વિશ્વમાં હાલ 23 જેટલા વયસ્ક લાઈગર છે, તેમાં સૌથી મોટા લાઈગરનું નામ હરક્યુલસ છે.
- ૧૦) મેડ્રીડમાં સંશોધકો દ્વારા 12 મીટર લાંબો અને 1.75 મીટર પહોળો વિશ્વનો સૌપ્રથમ થ્રીડી પ્રિન્ટેડ બ્રિજ બનાવવામાં આવ્યો છે.

6-2-2017

ગુજરાત

૧૧) કેશલેસ સિસ્ટમને વધારે સફળ બનાવવા માટે ગુજરાત એસ.ટી.નિગમ દ્વારા પહેલ કરવામાં આવી છે, આ બસોમાં ઈ-વોલેટથી 10 ટકા ડિસ્કાઉન્ટ સાથે ટીકીટ આપવામાં આવશે.

૧૨) રાજકોટમાં યોજાયેલી મેરેથોનમાં 4 મહિલા સ્પર્ધક સહીત 16 સ્પર્ધકો આંતરરાષ્ટ્રીય દોડવીરે ભાગ લીધો હતો.

૧૩) રાજકોટમાં યોજાયેલી મેરેથોન દેશમાં સૌથી મોટી અને એશિયામાં બીજા નંબરની સ્પર્ધા બની હતી.

રમત-જગત

૧૪) ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીને વિઝડન નામના મુખપત્રના કવર પેઈઝ પર સ્થાન આપવામાં આવેલ છે, સચિન બાદ તેઓ આ પેઈઝ પર બીજા ભારતીય ક્રિકેટર છે.

૧૫) ઘણા દેશોમાં ટી-20 ક્રિકેટ મેચની સફળતા બાદ દક્ષિણ આફ્રિકા પણ પોતાના યજમાન પદે ટી-20 લીગ શરુ કરશે.

૧૬) હરિયાણાના માનસેરમાં રમાયેલી નેશનલ ટેબલ ટેનીસની ચેમ્પિયનશીપમાં ગુજરાતનો સેમી ફાઈનલમાં પરાજય થતા બ્રોન્ઝમેડલ પ્રાપ્ત થયેલ છે.

અન્ય

૧૭) એક મહત્વપૂર્ણ પ્રાગ ઐતિહાસિક પર્વતીય કલા સાઈટ અમ્બુંકુથી પહાડીઓની તળેટીમાં જોવા મળેલ છે.

૧૮) ઓમનાકદ્દન નામનો એક ભરતનાટ્યમનો નૃત્યકાર પોતાના નૃત્ય દરમિયાન સ્ટેજ પર મૃત્યુ પામેલ છે.

૧૯) વિઝડન પત્રિકાને ક્રિકેટના બાઈબલ તરીકે ઓળખવામાં આવે છે.

૨૦) વિશ્વ ઈન્ટરફેસ સદભાવ સપ્તાહ ફેબ્રુઆરી 2011 થી ફેબ્રુઆરી માસના પ્રથમ સપ્તાહમાં મનાવવામાં આવે છે.

6-2-2017

સમીક્ષા 190(1) તારીખ 6/2/2017

દેશના રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રપતિ ભવનમાં વાર્ષિક ઉદ્યાનોત્સવનો પ્રારંભ કર્યો...

- ૧) રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી દ્વારા 4 ફેબ્રુઆરી 2017 ના રોજ રાષ્ટ્રપતિ ભવનનો વાર્ષિક ઉદ્યાનોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
- ૨) સામાન્ય માણસો માટે 5 ફેબ્રુઆરીથી 12 માર્ચ આ સોમવારને છોડતા ખુલ્લો રહેશે.
- ૩) આ સમય દરમિયાન લોકો સ્પ્રીચ્યુલ ગાર્ડન, હર્બલ ગાર્ડન, બોનસાઈન ગાર્ડન અને મ્યુઝીકલ ગાર્ડનનો લાભ ઉઠાવી શકશે.
- ૪) આ સમય દરમિયાન બગીચાઓના ભ્રમણ કરવા માટે કોઈ ઓન લાઈન બુકિંગ કરવામાં આવશે નહિ.
- ૫) આ સમયમાં ફરવા આવનાર લોકોને પ્રાથમિક સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
- ૬) મુગલ ગાર્ડન વિશિષ્ટ રૂપથી ખેડૂતો અને દિવ્યાંગો, સૈન્ય અને અર્ધ સૈન્ય બળ તથા અન્ય માટે 10 માર્ચ સુધી ખુલ્લો રહેશે.
- ૭) આ ઉદ્યાનોત્સવના પ્રારંભથી સામાન્ય લોકોને આ જગ્યા જોવાનો વિશેષ આનંદ મળે છે.

– પરેશ ચાવડા

6-2-2017

રોજે- રોજ આપના ફોનમાં જુકે, કરંટ અફેર્સ મેળવવા નીચેની લીંક પરથી એપ ડાઉનલોડ કરો.

<https://play.google.com/store/apps/details?id=com.edusafar>

વિડીયો ઘોરણ 10 પ્રકરણ 14 ના મલ્ટીપલ ચોઈસ ક્વેશ્ચન વિડીયો જુઓ નીચેની લિંક પરથી

<https://www.youtube.com/watch?v=a292hPWbE20>

ગણિત સાદું વ્યાજ વિડીયો ભાગ ચાર.માટે નીચેની લિંક ઓપન કરો.

<https://www.youtube.com/watch?v=v9uCYOeeN6A>

28 થી 31 જાન્યુઆરી કરંટ અફેર્સનો ગુજરાતી વિડીયો નીચેની લિંક પરથી જુઓ

<https://www.youtube.com/watch?v=4lmDCO8C4-Y>

બેસ્ટ જુકે વિડીયો માટે નીચેની લીંક ઓપન કરો.

https://www.youtube.com/channel/UCfDAM9P2RF_ynz8B_j5enC

મિત્રો, એજ્યુસફર દ્વારા **GK** ના વિડીયો અપલોડ કરવામાં આવ્યા છે આ માટે

YouTube પર જઈ, **EduSafar** લખી સર્ચ કરી, ચેનલ સબસ્ક્રાઈબ કરશો જેથી

GK વિડીયો ના નવા અપડેટ્સ મેઈલ પર મળતા રહેશે.